

JYOT INTERNATIONAL MARKETING LIMITED

Registered Office: Room No. 1, 1, Pandurang Society, Judges Bungalow Road, Bodakdev,
Ahmedabad, Gujarat - 380054

CIN: L65910GJ1989PLC012064 Website: www.jyotinternationalmarketing.co.in
Email: jyotimltd@gmail.com, info@jyotinternationalmarketing.co.in

Date: 05.02.2020

To,
The Department of Corporate Services,
BSE Limited
Ground Floor, P. J. Tower,
Dalal Street, Mumbai- 400 001,
Maharashtra, India

**Subject: Intimation of Publication of Board Meeting Advertisement for Quarter ended
December 31, 2019 in Newspaper.**

(Ref: Script Code No.: 542544)

Respected Sir/Madam,

Pursuant to Regulation 47 of SEBI (Listing of Obligation and Disclosure Requirements) Regulation, 2015, the Unaudited Financial Results (Standalone) for the Third Quarter ended on December 31, 2019 were duly published in following newspaper:

Business Standard and Jai Hind dated 05th February, 2020.

The copy of published Results is enclosed for your reference.

Kindly consider the same and take on record.

Thanking You

Yours faithfully,

For, Jyot International Marketing Limited




Kalubhai Kanzariya
Company Secretary & Compliance Officer

Place: Ahmedabad

*together with further interest @18% p.a. as applicable, incidental expenses, costs, charges etc. incurred up to the date of payment and/or relation thereof.

Disclosure of Encumbrances

To the best of the knowledge and information of the Authorised Officer of HDFC Limited, there are no encumbrances in respect of the above immovable properties/ secured assets.

Most Important Terms and Conditions

> Bid incremental Amount for all the above mentioned Properties/Secured Assets would be Rs. 10,000/- (Rupees Ten Thousand Only).

> Inspection of all the above mentioned Properties/Secured Assets would from 10 PM till 4 PM, date for inspection of Properties/Secured Assets in Vadodara it would be 18-Feb-20, Ankleshwar would be 19-Feb-2020 and for Bharuch it would be 20-Feb-20.

> For any further visits or assistance related to obtaining bid documents and for any other query, kindly contact Mr. Ajay Radadia Mobile No. 95124-46060 & Mr. Hardik Shah Tel. No. 89806-65665 for Properties/Secured Assets in Ankleshwar and Bharuch and Mr. Dharmendrasingh Chauhan through Mobile No. 76007-62777 or Mr. Rajiv Nair through Mobile No. 99798-97166 for Properties/Secured Assets Baroda.

Detailed Terms And Conditions

For detailed terms and conditions of the sale, please refer to the link provided in Housing Development Finance Corporation Limited (HDFC Ltd) Secured Creditor's website i.e. www.HDFC.Com

Date : 04-02-2020

Place : Vadodara

For Housing Development Finance Corporation Ltd.

**Sd/-
Authorised Officer**

Regd. Office: Ramon House, H T Parekh Marg, 169, Backbay Reclamation, Churchgate, Mumbai- 400020.

CIN : L70100MH977PLC019916. E-mail : customercare@hdfc.com, Website : www.hdfc.com

PSPCL Punjab State Power Corporation Limited
(Regd. Office: PSEB Head Office, The Mall Patiala - 147001, Corporate identity Number: U40109PB2010SGC033813 Website: www.pspcl.in)
E-Tender Enquiry No. 7164/P-1/EMP-11680 dtd. 31.01.2020 & ID: 2020_POWER_43892_1
Scope of Work: Procurement of Torried Biomass Pellets for GGSSTP, Rupnagar.
Qty. As per NIT EMD: Rs. 12,00,000/- fixed
Date & time up to which tender shall be received 03.03.2020 & 11:00 AM
Date & time of opening of tender 12.03.2020 & 11:30 AM
Tender specification can only be downloaded from PSPCL website <https://eproc.punjab.gov.in> & no hard copy of the same will be issued by this office.
Note:
1) In case any difficulty regarding uploading of the tender the prospective bidders are requested to get clarification from this office and/or eprocurement system Government of Punjab. Contact No.+91-(172)-2970263/284. It is also requested to get their digital signature well in time so as to submit tenders through e-tendering only.
2) It is informed that in case tender process is not completed due to any reason, no corrigendum will be published in newspapers. Details regarding corrigendum may be seen on website: eproc.punjab.gov.in.
Sd/- Dy.CE/Monitoring, GGSSTP, Rupnagar
C8855 RTP-04/2020

सेंट्रल बँक ऑफ इंडिया CENTRAL BANK OF INDIA
Bavla Branch : 7, 8, Narayan Estate, Nr. Jalaram Mandir, Sanand Road, Taluka - Bavla, Dist. Ahmedabad - 382220.
NOTICE FOR SALE OF MOVABLE PROPERTY (VEHICLE) BY PUBLIC AUCTION
Notice to public is hereby given to the effect that the movable property described therein will be sold by Central Bank of India by holding Public Auction on the date, Place and Times mentioned in this notice in "As is where is, whatever there is condition". Person interested in buying the said Vehicle may contact authorized Officer for further details/terms of sale.

Vehicle No.	Vehicle Type	Outstanding Amt.	Reserve Price
GJ-01-RW-6398	Owner Mr. Jasantkumar Ghanshyambhai Thakkar, FOUR WHEELER - MARUTI WAGON R - VXi BS 4 PETROL CAR-2017 MODAL	Rs. 4,29,977/-	Rs. 2,12,500/-

Date of Public Physical Auction: 06.03.2020, Time: 1.00 PM Venue of Auction: Regional Office, Laldarwaja, Ahmedabad. Last date of bid application and deposit of 10% of EMD: 05.03.2020, upto 4.00 PM at Bavla Branch OR Regional Office, Laldarwaja, Ahmedabad. The vehicle can be inspected on 26.02.2020 at following address: Central Bank of India, Regional Office, Laldarwaja, Ahmedabad, Branch Manager, Mr. Subodh Kumar Singh, (M) : 7567883805, Authorised Officer, Mr. G.R. Meena, Contact : 7567883840. Interested parties may on a simple paper writing clearly MARUTI WAGON R Registration Number deposit Earnest 10% amount (EMD) by way of Pay Order / DD to Bavla Branch OR Regional Office, Laldarwaja, on or before 05.03.2020 up to 4.00 PM. Successful bidder should deposit the remaining amount within 7 days. Bank reserve the right to accept or cancelled an offer without assigning any reason. Authorised Officer has right to Cancel / postpone action of an Vehicle. If borrower repay the dues before the date of auction, the proposed auction will be postponed / cancelled.
Sd/-
Authorised Officer, Central Bank of India
Date : 04.02.2020, Place : Ahmedabad

JYOT INTERNATIONAL MARKETING LIMITED
Regd. Office: Room No. 1, 1, Pandurang Society, Judges Bungalow Road, Bodakdev, Ahmedabad, Gujarat - 380054
CIN : L65910GJ1989PLC012064 Email id : info@jyotinternationalmarketing.co.in Phone : 9409054403 Website : www.jyotinternationalmarketing.co.in
NOTICE
Notice is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on 12th February, 2020 at 03:00 pm at the registered office of the Company to consider and approve the Un-audited Financial Results for the quarter ended on 31-12-2019 in compliance with Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015. The intimation will be made available on the BSE (www.bseindia.com) and Company website (www.jyotinternationalmarketing.co.in)
Date : 05-02-2020
Place: Ahmedabad
For, Jyot International Marketing Limited Sd/-
Kalubhai Kanariya - Company Secretary

NEELACHAL ISPAT NIGAM LIMITED
Kalinga Nagar Industrial Complex, Duburi - 755026, Jajpur, Odisha
OPEN TENDER NOTICE
Tdr.No.:NINL/CC/19-20/CO/TDR-122 Date: 01.02.2020
Annual job contract for deployment of manpower for mechanical maintenance assisted jobs in CDCP & BPP of coke oven, inside NINL premises.
Last date of tender submission : 24.02.2020 up to 3PM
Details available on our website : www.ninl.in
Corrigendum, extension etc shall be notified on website only.
Sr. Mgr.(WCC)
Tel.: 06726-264068

बँक ऑफ बड़ोदा Bank of Baroda
Kathal Branch - Kathal, Ta., Kathal, Dist.: Kheda-387630, Gujarat, India (H.O.Baroda) Phone : 91 02691 243427 Nr.Bus stop Dudhmandli Dairy Email : kathla@bankofbaroda.com
[See rule-8(1)] POSSESSION NOTICE (For Immovable property)
Whereas The undersigned being the authorized officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand Notice dated 14/10/2019 calling upon the borrower Mr. Mansinh Sadabhai Dabhi to repay the amount mentioned in the notice being Rs. 10,90,214.14 (Rupees Ten lakh Ninety thousand Two hundred Fourteen & Fourteen paise only) + unapplied int & further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment within 60 days from the date of receipt of the said notice.
The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the Public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of section 13 of the Act read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this the 29th day of Jan of the year 2020.
The Borrower/Guarantors/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda for an Rs. 10,90,214.14 (Rupees Ten lakh Ninety thousand Two hundred Fourteen & Fourteen paise only) + unapplied int and further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment.
The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.
Description of the Immovable Property
All that part and parcel of the property at Bagdol, Ta Kathal, Dist Kheda bearing land and building of Gram Panchayat Property no. 312 admeasuring 109.08 sq.mtrs situated at Mahadev Faliyug belongs to Mr. Mansinh Sadabhai Dabhi. Bounded By : East: House of Mr. Khumansinh Motibhai, West: house of Mr. Ravjibhai Bhemjibhai, North: Mansinh Sadabhai, South: Public road
Date: 29/01/2020, Chief Manager & Authorized Officer
Place: Kathal, Bank of Baroda

SAVITA Savita Oil Technologies Limited
CIN - L24100MH1961PLC012066
Registered Office: 66/67, Nariman Bhavan, Nariman Point, Mumbai - 400 021, India Tel: 91 22 6624 6200 / 6624 6228; Fax: 91 22 2202 9364 E-mail : legal@savita.com; Website : www.savita.com
SAVSOL | TRANSOL
Statement of Unaudited Standalone Financial Results for the Quarter and Nine Months ended 31st December, 2019 ₹ in lakhs

Particulars	Quarter ended	Nine Months	Quarter
	31.12.2019	31.12.2019	ended
	Unaudited	Unaudited	Unaudited
Total Income from Operations (net)	52,187.19	1,60,488.99	62,059.60
Net Profit for the period (before tax, Exceptional and / or Extraordinary items)	3,364.44	10,545.62	6,019.10
Net Profit for the period before tax (after Exceptional and / or Extraordinary items)	3,364.44	10,545.62	6,019.10
Net Profit for the period after tax (after Exceptional and / or Extraordinary items)	2,162.84	7,503.77	4,447.98
Total Comprehensive Income for the period [comprising profit for the period (after tax) and other comprehensive income (after tax)]	2,146.81	7,474.11	4,443.86
Paid up Equity share capital (Face value of ₹ 10 each)	1,407.11	1,407.11	1,432.21
Reserves (excluding Revaluation Reserve as shown in the balance sheet of previous year)	Not applicable	Not applicable	Not applicable
Earnings per share (of ₹ 10 each)			
Basic: ₹	15.24	52.88	31.06
Diluted: ₹	15.24	52.88	31.06

Notes:
1) The above is an extract of the detailed format of the Financial Results for the Quarter ended 31st December, 2019 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the Quarter ended 31st December, 2019 is available on the stock exchange websites (www.bseindia.com), (www.nseindia.com) and on the Company's website (www.savita.com).
2) The above unaudited financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on Monday, 3rd February, 2020.
For Savita Oil Technologies Limited
Gautam N. Mehra
Chairman and Managing Director
(DIN:00296615)
Mumbai
3rd February, 2020

TVS MOTOR COMPANY LIMITED **TVS**
Regd office: "Chaitanya", No. 12, Khader Nawaz Khan Road, Nungambakkam, Chennai 600 006
Website: www.tvs-motor.com Telephone No. (044) 28332115 Fax No. (044) 28332113 Email: contactus@tvs-motor.com
CIN:L35921TN1992PLC022845
STATEMENT OF UNAUDITED STANDALONE & CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER 2019 (Rs. in Crores)

S. No	Particulars	Standalone			Consolidated		
		Quarter ended	Nine Months ended	Quarter ended	Quarter ended	Nine Months ended	Quarter ended
		31.12.2019	31.12.2018	31.12.2018	31.12.2019	31.12.2018	31.12.2018
1	Total Income	4,126.35	12,948.91	4,664.63	4,779.32	14,772.47	5,123.50
2	Net Profit (before tax, Exceptional items)	221.77	664.58	258.45	277.32	750.59	289.40
3	Net Profit before tax (after Exceptional items)	145.73	664.58	258.45	201.28	750.59	289.40
4	Net Profit after tax (after Exceptional items)	121.07	518.38	178.39	156.84	564.96	197.79
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	122.01	472.18	193.06	172.44	536.51	223.12
6	Equity Share Capital (Face value of Re.1/- each)	47.51	47.51	47.51	47.51	47.51	47.51
7	Reserves (excluding Revaluation Reserve)	-	-	-	-	-	-
8	Earnings Per Share (Face value of Re. 1/- each) (not annualised)						
	(i) Basic (in Rs.)	2.55	10.91	3.75	3.17	11.59	4.29
	(ii) Diluted (in Rs.)	2.55	10.91	3.75	3.17	11.59	4.29

Notes:
1 The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results are available on the Stock exchange websites (www.bseindia.com) and (www.nseindia.com) and on company's website (www.tvs-motor.com).
2 The board at its meeting held today, declared an interim dividend of Rs. 2.10 per share (210%) absorbing a sum of Rs. 120.28 Crores including Dividend Distribution Tax (DDT) for the year 2019-20, the same will be paid to those shareholders who hold shares in physical form and / or in electronic form and whose names appear in the Register of Members and / or Depositories respectively, as at the close of working hours on 12th February 2020 (Record date).
3 Effective 1st April 2019, the Company has adopted Ind AS 116 "Leases", using the modified retrospective method and applied the Standard to its leases retrospectively and has recognised the effect of the cumulative adjustment in the opening balance of retained earnings, on the date of initial application (1st April 2019). Comparatives for the period prior to the current quarter / nine months ended have not been restated.
Place : Chennai
Date : 4th February 2020
For TVS Motor Company Limited
Sd/-
Chairman

SIEMENS
NOTICE
Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held on Tuesday, 11th February, 2020, to consider, inter-alia, the Un-audited Financial Results alongwith the Statement of Segment wise Report for the 1st quarter ended 31st December, 2019.
This intimation is also available on the website of the Company at www.siemens.co.in and on the website of the Stock Exchanges where the shares of the Company are listed at www.bseindia.com and www.nseindia.com
For Siemens Limited
Sd/-
Ketan Thaker
Company Secretary
Date : 4th February, 2020
Place: Mumbai
Siemens Limited
CIN: L28920MH1957PLC010839
Regd. Office:
Birla Aurora, Level 21, Plot No. 1080,
Dr. Annie Besant Road, Worli, Mumbai - 400030.
Tel.: +91 22 3967 7000 | Fax: +91 22 2436 2403
Website: www.siemens.co.in
Contact / E-mail: Corporate-Secretariat.in@siemens.com / www.siemens.co.in/contact

SHRIRAM **SHRIRAM TRANSPORT FINANCE COMPANY LIMITED**
CIN: L65191TN1979PLC007874
Regd. Office: Mookambika Complex, 3rd Floor, No. 4, Lady Desika Road, Mylapore, Chennai - 600 004
Tel No: +91 44 2499 0356, Fax: +91 44 2499 3272. Website: www.stfc.in, email: secretarial@stfc.in
Extract of Unaudited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2019 (₹ in crores)

Particulars	Standalone				Consolidated			
	Quarter Ended	Nine Months Ended	Quarter Ended	Year Ended	Quarter Ended	Nine Months Ended	Quarter Ended	Year Ended
	31.12.2019	31.12.2019	31.12.2018	31.03.2019	31.12.2019	31.12.2019	31.12.2018	31.03.2019
Total income from operations	4,286	12,557	3,991	15,522	4,286	12,557	3,991	15,522
Net Profit for the period (before tax, exceptional and/or extraordinary items)	1,186	3,095	984	3,778	1,186	3,095	984	3,778
Net Profit for the period before tax (after exceptional and/or extraordinary items)	1,186	3,095	984	3,778	1,186	3,095	984	3,778
Net Profit for the period after tax (after exceptional and/or extraordinary items)	879	2,278	635	2,564	879	2,278	635	2,564
Net Profit for the period after tax (share of profit of associate)	879	2,278	635	2,564	882	2,288	639	2,576
Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	880	2,275	634	2,562	883	2,284	637	2,573
Paid-up equity share capital (face value ₹ 10/- per share)	227	227	227	227	227	227	227	227
Other equity				15,609				15,736
Earnings per share (before and after extraordinary items) (of ₹ 10/- each)								
Basic (₹)	38.75	100.43	28.02	113.01	38.88	100.84	28.15	113.52
Diluted (₹)	38.75	100.43	28.02	113.01	38.88	100.84	28.15	113.52

Note:
The above is an extract of the detailed format of Quarterly/Nine months Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Nine months Financial Results is available on the stock exchange websites: www.bseindia.com, www.nseindia.com and company's website: www.stfc.in.
Place : Chennai
Date : February 03, 2020
By order of the Board
For Shriram Transport Finance Company Limited
Umesh Revankar
Managing Director & CEO
DIN : 00141189

